
052(G)
(MARCH, 2010)

Time : 3.00 Hours!

(Maximum Marks : 100)

મુખ્યનામી

- આ પ્રશ્નપત્રમાં કુલ ચાર વિભાગ અને 60 પ્રશ્નો છે.
 - બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
 - પ્રશ્નની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે.
 - પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખવા જરૂર જાણાય ત્યાં આકૃતિ તેમજ પ્રક્રિયાઓ આપવી.
 - નવો વિભાગ નવા પાના પર લખવો.
 - ગણતરી માટે બોર્ડફાર્મ આપવામાં આવતા લોગોબલ અથવા સાદ્ય કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે.
 - આકૃતિ માટે પેનિલ અને ઉત્તરો લખવામાં બલ્યુ પેનનો જ ઉપયોગ કરવો.
 - અચળાંક : $R = 1.987$ કેલરી/મોકે.

$$R = 8.314 \text{ J/K/mol}$$

$$h = 6.626 \times 10^{-34} \text{ एर्ग-सेकंड}$$

9. परभाणुबार (आम/भोल) : $H = 1, O = 16, C = 12, N = 14, Na = 23, S = 32, Cl = 35.5, Ag = 108$.

विभाग - A

- નીચે આપેલા 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ 16
 (A, B, C, D) પસંદ કરીને જવાબ લખો દ્વેકનો 1 ગુણ છે.

 1. O_2^+ અણુ આયનમાં કુસ e^- સંખ્યા 15 છે. તેના સંદર્ભે સાચુ વિધાન ક્યું છે?
 - A) તેની સ્થિરતા O_2 અણુ કરતાં ઓછી છે.
 - B) તેનો બંધકમાંક O_2 કરતાં મોટો જ્યારે બંધલંબાઈ O_2 થી વધારે છે.
 - C) તે ધનયુદ્ધિત હોવાથી પ્રતિયુભકીય છે.
 - D) તેની $\pi^* 2P_x$ અને $\pi^* 2P_y$ આરૂપીય કક્ષકો અધુર્ગીત હોવાથી અનુયુભકીય છે.
 2. ફલક કેન્દ્રિત ધનના એકમ કોષ્ઠમાં ફલકના મધ્યે રહેલો પરમાણુ કેટલા એકમ કોષ્ઠમાં સહિયારો છે?
 - A) 2
 - B) 3
 - C) 4
 - D) 8

3. શાખળુરુ ક્ષય પ્રકારનું સિલિકેટ છે?
- ઓર્થો સિલિકેટ
 - પાથરો સિલિકેટ
 - ટ્રિપરિમાણાત્મક સિલિકેટ
 - વલય સિલિકેટ
4. અભ્યાધપરીલ દ્વારા ધરાવતા દ્રાવણનું બાખ્યદાણ કેના સમગ્રમાણમાં હોય છે?
- દ્રાવકના મોલ અંશ
 - દ્રાવકના ઉત્કલનબિંદુ
 - દ્રાવણના કદ
 - દ્રાવણની મંદનજિધમા
5. ઉભાગતિશાસ્કની દિનિએ ક્ષો સંબંધ સાચો નથી?
- $\Delta G^0 = - nFE^0$
 - $\Delta H = \Delta E + P \cdot \Delta v$
 - $K = e^{-\frac{\Delta G}{RT}}$
 - $\Delta G = \Delta H + T \cdot \Delta S$
6. સૂક્ષ્મોધમાં ક્ષય પદાર્થનું રિડક્ષન થાય છે?
- MnO_2
 - $KMnO_4$
 - NH_4Cl
 - $ZnCl_2$
7. સ્મૃતિનો અદભૂત ગુણ ધરાવતી મિશ્રધાતુમાં ઘટક તત્ત્વોનું પ્રમાણ કર્યું છે?
- 45% Ti અને 55% Ni
 - 8% Ni, 18% Cr બાકીનું Fe
 - 67% to 70% Ni, બાકીનું Cu
 - 60% Ni અને 40% Cr.
8. નીચેનાખાંથી ક્ષો લિઝેન્ડ Ni^{2+} સાથે જોડાણથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ રચ્શો?
- H_2O
 - CN^-
 - NH_3
 - Cl^-
9. નીચેનાખાંથી પ્રેરિત રેડિયો એક્ટીવ પ્રક્રિયા નક્કી કરો.
- $^{27}_{13}Al + ^4_2He \longrightarrow ^{30}_{15}P + ^1_0n$
 - $^{133}_{56}Ba + ^{-1}_0e \longrightarrow ^{133}_{55}Cs + \beta-\text{કિરણો}$
 - $^{22}_{11}Na \longrightarrow ^{22}_{12}Mg + ^0_{-1}\beta$
 - $^{30}_{15}P \longrightarrow ^{30}_{14}Si + ^0_{+1}\beta$

10. એસિટાલ્ફિલાઈડનું $KMnO_4$ વડે ઓક્સિડેશન કરવાથી મળતી નીપજમાંથી બિથેન મેળવવા કઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે?

 - A) ટોલેન્સ પ્રક્રિયા
 - B) આલ્ડોલ સંઘનન
 - C) $LiAlH_4$ વડે રિફ્ઝન
 - D) સોડલાઈમ વડે ડિકાર્બોક્સિલેશન

11. ઇથેન-1, 2-ડાયોલનો કયો ગુણવર્મ સાચો નથી?

 - A) તેનું ઉત્કલન બિંદુ ઇથેનોલ કરતાં ઉચ્ચ છે.
 - B) ટેરીલીન પોલિમર માટેનો મોનોમર છે.
 - C) તે પાણીમાં અદ્ભુત છે.
 - D) તે રંગવિહિન અને ચાસણી જેવું પ્રવાહી છે.

12. એસિટોફિનોન સથે $Zn/Hg + સાંદ્ર HCl$ ની પ્રક્રિયાથી કઈ નીપજ મળે?

 - A) બેન્ઝોઈક એસિડ
 - B) સેલિસાલ્ફિલાઈડ
 - C) ઈથાઈલ બેન્ઝિન
 - D) 1-ફીનાઈલ -1િથેનોલ

13. R-S નામકરણમાં સમૂહોની અગ્રોમતાના ઉત્તરતા કમની સાચી ગોઠવણી કઈ છે?

 - A) $-I, -NO_2, -CHO, -CH_2CH_3$
 - B) $-CHO, -COOH, -OH, -CH_3$
 - C) $-CHO, -COOH, -OCH_3, -I$
 - D) $-NH_2, -OH, -NO_2, -CH_3$

14. 2,3-ડાયલાઈટ્રોકિસ બ્યુટેનોઈક એસિડ માટે કેટલા વિન્યાસ સ્વરૂપો બને?

 - A) 2
 - B) 4
 - C) 8
 - D) 3

15. ક્ષો જૈવિક અલ્ફુ લાંબી શૃંખલાવાળી બેકી સંપ્રા ધરાવતા મોનો હાઇડ્રોક આલ્કોહોલ તથા લાંબી શૃંખલા ધરાવતા ચરબી એસિડનો એસ્ટર છે?

 - A) DNA
 - B) સેલ્ફુલોજ
 - C) સ્થર્ચ
 - D) કાર્ન્યુલા વેક્સ

16. સાંસ્કેરિત ગાંધી પદ્ધતિ સેક્રેટનનો ગણપણ આંક કેટલો થશે?

 - A) 2000
 - B) 160
 - C) 550
 - D) 650

વિભાગ - B

□ નીચે આપેલા 17 થી 32 પ્રશ્નોના જવાબ એક વિધાનમાં આપો દરેક પ્રશ્નનો 1 ગુણ છે. 16 □

17. PCl_5 આણુ માટે સંક્રાણનો પ્રકાર અને અણુનો બૌમિતિક આકાર જણાવો.
18. દ્રાવ્ય ઘન અને દ્રાવક વાયુ હોય તેવા દ્રાવણનું ઉદાહરણ આપો.
19. વ્યાખ્યા : પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા
20. વિધૂત રાસાયણિક કોષના E-cell નું મૂલ્ય શાના પર આધાર રાખે છે? (બે પરિબળો લખો.)
21. ગ કમની રાસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું પરિમાણ લખો.
22. કોઈ કિમ ક્યા પ્રકારનું ઈમલણ છે? રંગ કસોટીમાં તે કેવું અવલોકન આપે?
23. પોટેશિયમ કલોરેટનું સૂત્ર લખો, અને કોઈ એક ઉપયોગ જણાવો.
24. સિલ્વરની મંદ નાઈટ્રિક ઓસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો.
25. $[Co(NH_3)_3 (NO_2)_3]$ સંક્રાણનાં બે બૌમિતિક સમઘટકોનાં બંધારણ (મેરિટિયોનલ અને ફેસિયલ માટે) આપો.
26. વિખંડનીય $^{239}_{92}U$ માંથી $^{239}_{94}Pu$ મેળવવાની કેન્દ્રિય પ્રક્રિયા આપો.
27. Bq (બેકવેરલ) એટલે શું? 1 Ci = કેટલા બેકવેરલ થશો?
28. બેન્જેમાઈડમાંથી એનિલીન મેળવવાની રાસાયણિક પ્રક્રિયા આપો.
29. આઈસો પ્રોપાઈલ ઓમાઈનનું IUPAC નામ લખો. તે ક્યા પ્રકારનો ઓમાઈન છે જણાવો.
30. સંધનન પોલિમર કોને કહેવાય?
31. DNA માં રલેલા બેઇઝનાં નામ જણાવો. (ગમે તે બે)
32. ખોરાકની જણવણી માટે ઉપયોગી કોઈ બે એન્ટિઓક્સિડન્ટસના નામ લખાવો.

વિભાગ - C

6

- નીચે આપેલા 33 થી 48 પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ લખો. દરેક પ્રશ્નના 2 ગુણ છે. 32

33. $Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \longrightarrow Cu_{(s)} + Zn^{2+}_{(aq)}$ કોષ પ્રક્રિયા ધરાવતા ગેલ્વેનીક કોષની રૂચના દર્શાવતી આકૃતિ હોયી નામ નિર્દેશ કરો. કોષમાં રહેલા ક્ષારસેતુનું કાર્ય જણાવો.

અથવા

વિધુત વિભાજન એટલે શું? તેનું મહત્વ જણાવો.

34. 8.5 એમિસ્ટર પ્રવાહ 30 મિનિટ સુધી $AgNO_3(aq)$ ના દ્રાવણમાંથી પસાર કરતાં જો કેથેડ પર 15.753 ગ્રામ ચાંદી જમા થતી હોય તો કોષની વિધુતપ્રવાહની ક્ષમતા કેટલી ગણાય?

(પરમાળુભાર $Ag = 108$ ગ્રામ/મોલ)

35. પ્રથમ કમની રસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંક અને $t_{0.5}$ નાં સમીકરણો લખો. આ પ્રક્રિયાના $\log R \longrightarrow \text{time } 't'$ (સમય) ના આલેખથી મળતા છાળ અને આંતિક્રોના મૂલ્યો લખો.

36. $CH_3CH_2CH_2I + OH^{-}_{(aq)} \longrightarrow CH_3CH_2CH_2OH + I^{-}_{(aq)}$ પ્રક્રિયા માટે 27°C તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય 1.84 (મોલ/લિટર) $^{-1}$ મિનિટ $^{-1}$ છે. અને 327 K તાપમાને તેનું મૂલ્ય 38.84 (મો/લિ) $^{-1}$ મિનિટ $^{-1}$ હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ગણો.

37. કોટ્રેલ ઘુમાડા અવક્ષેપક પર ટૂંકોંધ લખો (આકૃતિ જરૂરી નથી)

38. સેન્ટ્રિટ H_2SO_4 માં H-બંધની રીતી અસર જોવા મળે છે? તેની કાર્બોહાઇડ્રેટ્સ સાથેની પ્રક્રિયા સમજાવો.

અથવા

સિલિકોન્સ વિશે માહિતી આપો.

39. $FeCl_3$ નું જલીય દ્રાવણ રંગીન છે. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો.

અથવા

Co ($Z = 27$) ના કલોરાઈડની ચુંબકીય ચાકમાત્રા 4.90 BM છે. તેમાં રહેલા અધ્યુમિત e^- ની સંખ્યા ગણો. ધારુ આપનની e^- રૂચના અને તે સંયોજનનું સૂત લખો.

40. દેન્થેનાઈડ તત્વોનાં ઉપયોગ જણાવો. (કોર્ટીપણ ચાર)

41. કિસેટ ચિકિત્સા પદ્ધતિ શું છે? તેની ઉપયોગીતા લખો.

અથવા

$[Fe(H_2O)_6]^{3+}$ માટે સંકરણ અને ચુંબકીય ગુણની વિગત આપો.

42. કેન્દ્રિય પીગલન પ્રક્રિયા સમજાવો

અથવા

ટ્રેસર વિધિ શું છે? વિવિધ ક્ષેત્રોમાં તેની મહત્વતા જાણાવો.

43. કણ પ્રવેગકો ફોને કણે છે? તેના દ્વારા કૃતિમ રીતે થતી કેન્દ્રિય પ્રક્રિયાઓ કેવી રીતે શક્ય બને છે?

44. પરિવર્તન લખો : બેન્ઝોઇક એસિડમાંથી ટોલ્યુફીન મેળવો (પ્રક્રિયકો અને નીપળેનાં નામ તેમજ પ્રક્રિયા પરિસ્થિતિ, તાપમાન, દખાણ હરાવવા જરૂરી)

45. ઈથેનાલ સાથે CH_3MgI ની પોયશાલ પ્રક્રિયાથી અલ્કોહોલ મેળવો. મળતો અલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કેવું અવલોકન આપશો?

46. પોલિસ્ટ્રાયરીનની બનાવટનું સમીકરણ આપો તેના ગુણધર્મ અને ઉપયોગ આપો.

47. સાયનાઈડનું ઇલેક્ટ્રોનીય બંધારણ, સંકરણ આપો. એસિટોનાઈટ્રોઇલ કાર્બનિક પ્રક્રિયામાં દ્રાવક તરીકે ઉપયોગી છે. શાથી?

48. કલોરોબેન્જિનમાંથી ફિનાઈલ આઈસોસાયનાઈડ મેળવવાની પ્રક્રિયાના તબક્કા સમજાવો.

બિભાગ - D

- નીચે આપેલા 49 થી 60 નિબંધ પ્રકારના વિસ્તૃત જવાબી પ્રશ્નો છે. દરેક પ્રશ્નના છ ગુણ છે. 36

49. ક્વોન્ટમ આંક એટલે શું? તેના પ્રકારો લખો અને કોણીય કેગમાન ક્વોન્ટમ આંક (I) બિંદુઓ લખો.

અથવા

શ્રોડિન્જર સમીકરણના આધારે હાઈડ્રોજનના ઇલેક્ટ્રોન માટેની રાહિલી kcal/mol e^- એકમ માં ગણો.

50. બિંદુ ક્ષતિની વ્યાખ્યા આપો. તેના પ્રકારો જણાવો. ફેન્કલ ક્ષતિ સવિસ્તાર સમજાવો.

51. 25°C તાપમાને 2.7 લિટર પાણીમાંથી O_2 વાયુ પસાર કરતાં કેટલા મિલિગ્રામ દ્રાવ્ય થશે? તેની દ્રાવ્યતા ppm માં ગણો. (આશુભાર $O_2 = 32$ ગ્રામ/મોલ)

$$K_H = 3.0 \times 10^{-4} \text{ બાર}, PO_2 = 2.4 \times 10^{-8} \text{ બાર.}$$

52. 100°C તાપમાને 1 મોલ પાણીનું વરાળમાં ફ્લ્યાંટર કરવા માટે 9720 કેલરી ઉદ્ઘાની જરૂર પડે છે. 100 ગ્રામ પાણીનું જો તેના ઉત્કલન બિંદુએ વરાળમાં ફ્લ્યાંટર કરવામાં આવે તો પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીયાં કેટલો ફેફાર થશે? આ પ્રકમ આપમેળે થશે? (પર્યાવરણ માટેનું તાપમાન 25°C ગણવું)

અથવા

25°C તાપમાને 4.28 મોલ આદર્શ વાયુ ધરાવતા બંધ પાત્રનું દખાણ પણ વાતાવરણથી વધારી 20 વાતાવરણ કરવામાં આવે તો આ પ્રકમ માટે મુક્ત ઊર્જાનો ફેફાર ΔG ગણો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો.

53. અધિશોષણ પર અસર કરતા પરિબળો જણાવો. અધિશોષણની ઘટના પર અધિશોષિતના સ્વભાવની અસર સમજાવો.

54. ફોસ્ફરસના અપક્રિયા સવિસ્તાર સમજાવો.

55. ઓર્ગાનિકેટાલિક સંયોજનો સવિસ્તાર સમજવો. સંયોજનાની સરથના દોરો.

56. રંધ્રીય સમઘટકતા અને ભૌમિકિક સમઘટકતા ઉદાહરણાનુસાર સમજવો.

୨୫୩

પ્રકાશ કિયારીલ પદ્ધાર્થ કોને કહેવાય? તેનાં પ્રકારો સમજાવો પ્રકાશ કિયારીલતાનો ગુણ પદ્ધાર્થમાં ક્યારે ઉદ્ભબે? લેક્ટીક એસિડનાં પ્રકાશ સમઘટકોનાં બંધુરણ દોરે.

57. ટિનોલના ઉત્પાદનની ક્ષુભિન પદ્ધતિ વર્ણાવો. ટિનોલનાં કોઈપણ બે ઉપયોગ જાળાવો.

58. PHBV ની બનાવટ અને ઉપયોગદ્વારા સમજાવો.

અથવા

વહેનાઈકું રબરની બનાવટ અને ઉપયોગીતા સમજાવો.

59. ટૂંકનોંધ લખો : a) હોમોન્સ b) ઓલિગોમેન્ડ્રાઇવ

60. રોજિંટા જીવનમાં ડિટરજનન્ટનો ઉપયોગ સાખુ કરતાં વધુ છે, શાથી? કેટાયોનિક ડિટરજન્ટ અને બિન આયોનિક ડિટરજન્ટ વિશે માહિતી અપ્પો.

୩୫

ટ્રેકન્ડાય લખો : a) પરક્ષુમ b) ટેલ્કમ પાવહર